

બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદ

MBBS પ્રવેશ 2026 – સર્વિસ બોન્ડ

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

ગુજરાતની સરકારી મેડિકલ કોલેજમાં MBBS માં પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થીએ બોન્ડ રજૂ કરવાનો રહે છે. આ બોન્ડ એ બાંહેધરી છે કે વિદ્યાર્થી MBBS પૂર્ણ કર્યા બાદ પેરિફેરલ (સરકારી) હોસ્પિટલોમાં ફરજિયાત સેવા પૂર્ણ કરશે. નવા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા બોન્ડના દસ્તાવેજો વિશે વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબ આ FAQ માં આપેલ છે.

એક નજરે

વિગત	ભાગ A: ₹5 લાખ	ભાગ B: ₹15 લાખ
શું છે	બોન્ડ માટેની સિક્યોરિટી, બે માંથી કોઈ એક રીતે આપવાની	એફિડેવિટ (બાંહેધરી પત્ર)
કેવી રીતે આપવું	વિકલ્પ 1: ₹5 લાખની FD સાથે બેંક ગેરંટી અથવા વિકલ્પ 2: ઓછામાં ઓછી ₹5 લાખની કિંમતની મિલકત પર સોલ્વન્સી સર્ટિફિકેટ	આપેલ નમૂના મુજબ ₹300 ના સ્ટેમ્પ પેપર પર સાદું એફિડેવિટ
મુદત	બેંક ગેરંટી અને FD: 7 વર્ષ. સોલ્વન્સી: કોઈ નિશ્ચિત મુદત નથી; બોન્ડની શરતો પૂર્ણ થાય ત્યાં સુધી રહે છે	લાગુ પડતું નથી
સહી	વિદ્યાર્થી, વાલી, 2 સ્યોરિટી (જામીન), 2 સાક્ષી	વિદ્યાર્થી, વાલી, 2 સ્યોરિટી (જામીન), 2 સાક્ષી

દસ્તાવેજો જમા કરાવવાની છેલ્લી તારીખ: 15 ઓક્ટોબર 2026 પહેલાં

1. બોન્ડ કોને લાગુ પડે છે

પ્ર.1 ઓલ ઇન્ડિયા ક્વોટાથી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને બોન્ડ લાગુ પડે?

હા. ગુજરાતની 6 સરકારી મેડિકલ કોલેજોમાં ઓલ ઇન્ડિયા ક્વોટા કે સ્ટેટ ક્વોટા, કોઈપણ રીતે પ્રવેશ લેનાર તમામ વિદ્યાર્થીઓને બોન્ડ લાગુ પડે છે. તે તમામે બોન્ડના કાગળો રજૂ કરવાના રહેશે.

પ્ર.2 સરકારી બેઠક પર ઓલ ઇન્ડિયા ક્વોટાથી આવેલ વિદ્યાર્થીઓએ પણ બેંક ગેરંટી આપવાની રહેશે?

હા. ઓલ ઇન્ડિયા ક્વોટાના વિદ્યાર્થીઓએ પણ સ્ટેટ ક્વોટાના વિદ્યાર્થીઓ જેવા જ બોન્ડના દસ્તાવેજો આપવાના રહેશે. ₹5 લાખના ભાગ માટે બેંક ગેરંટી અથવા સોલ્વન્સી સર્ટિફિકેટ, બે માંથી કોઈ એક આપી શકાય (જુઓ પ્ર.4).

પ્ર.3 બોન્ડ બનાવવા માટે ડીન ઓફિસની મુલાકાત લેવી પડશે?

ના. આપેલ નમૂના મુજબ તમારી બેંક અથવા મામલતદાર/તહસીલદાર કચેરીની મદદથી દસ્તાવેજો જાતે તૈયાર કરો અને પછી કોલેજમાં જમા કરાવો.

2. બોન્ડને સમજાવો

પ્ર.4 ₹20 લાખના બોન્ડમાં શું શું સામેલ છે?

બોન્ડના બે ભાગ છે:

- ભાગ A: ₹5 લાખ. આ સિક્યોરિટીનો ભાગ છે. તેમાં કાં તો બેંક ગેરંટી (ફિક્સ્ડ ડિપોઝિટ સાથે) અથવા મિલકત પર સોલ્વન્સી સર્ટિફિકેટ આપવાનું રહે છે. વિગત વિભાગ 3 અને 4 માં છે.
- ભાગ B: ₹15 લાખ. આપેલ નમૂના મુજબ ₹300 ના સ્ટેમ્પ પેપર પર સાદું એક્ઝિડેવિટ. વિગત વિભાગ 5 માં છે.

પ્ર.5 ₹5 લાખ માટે સોલ્વન્સી સર્ટિફિકેટ અને બેંક FD બંને જોઈએ કે કોઈ એક?

કોઈ એક જ. બેંક ગેરંટી (FD સાથે) અથવા સોલ્વન્સી સર્ટિફિકેટ આપો. બંનેની જરૂર નથી.

પ્ર.6 ટૂંકમાં, કયા કયા દસ્તાવેજો જોઈએ? (આ ચારેય દસ્તાવેજ ના ફોર્મેટ વેબસાઇટ પર છે.)

જરૂરી દસ્તાવેજો:

- ₹5 લાખ: આપેલ નમૂના મુજબ બેંક ગેરંટી અથવા સોલ્વન્સી સર્ટિફિકેટ, તેમજ
- ₹5 લાખનો બોન્ડ દસ્તાવેજ.
- ₹15 લાખ: આપેલ નમૂના મુજબ ₹300 ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરી પત્ર (એક્ઝિડેવિટ).

3. વિકલ્પ 1: બેંક ગેરંટી (ફિક્સ્ડ ડિપોઝિટ સાથે)

પ્ર.7 બેંક ગેરંટી કેવી રીતે આપવી?

- 7 વર્ષ ની મુદત માટે ₹5,00,000 ની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરાવો.
- વિદ્યાર્થી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો (પુખ્ત) હોય તો FD વિદ્યાર્થીના નામે કરાવો. વિદ્યાર્થી 18 વર્ષથી ઓછી ઉંમરનો (સગીર) હોય તો FD પિતા અથવા માતાના નામે કરાવો.
- કોલેજ દ્વારા આપેલ બેંક ગેરંટીનો નમૂનો તમારી બેંકમાં લઈ જાઓ. બેંક 7 વર્ષની મુદતની બેંક ગેરંટી આપશે અને પ્રક્રિયામાં માર્ગદર્શન આપશે.

જમા કરાવવાના દસ્તાવેજો:

- બેંક દ્વારા આપવામાં આવેલ બેંક ગેરંટીનો દસ્તાવેજ. નોટરી કરાવવાની જરૂર નથી. મુદત: 7 વર્ષ.
- ₹5 લાખની FD ના દસ્તાવેજ. મુદત: 7 વર્ષ.
- વિદ્યાર્થી, વાલી, 2 સ્વોરિટી અને 2 સાક્ષીની સહી સાથેનો ₹5 લાખનો બોન્ડ દસ્તાવેજ.

પ્ર.8 કયો બેંક ગેરંટી નમૂનો વાપરવો: સામાન્ય કે 18 વર્ષથી ઓછી ઉંમર માટેનો? તેનો નમૂનો મોકલી શકશો?

સરકાર દ્વારા બે નમૂના આપવામાં આવ્યા છે: એક 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ માટે અને એક 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ માટે. બંને વિદ્યાર્થીઓના ગ્રુપમાં મૂકવામાં આવ્યા છે. વિદ્યાર્થીની ઉંમર મુજબનો નમૂનો વાપરો. દરેક બેંક નમૂનામાં થોડા ફેરફાર કરી શકે છે. તે માન્ય છે, પરંતુ બેંક ગેરંટી સંબંધિત કોલેજના ડીનની તરફેણમાં હોવી જોઈએ, જેથી બોન્ડની શરતોનું પાલન ન થાય તો રકમ મેળવી શકાય.

પ્ર.9 બેંક ગેરંટી કેટલા વર્ષ માટે બનાવવી? એક્સપાયરી તારીખ અને કલેઈમ એક્સપાયરી તારીખ શું રાખવી?

બેંક ગેરંટી અને FD બંને 7 વર્ષ માટે હોવા જોઈએ.

પ્ર.10 બેંક ગેરંટી અમદાવાદની બેંકમાંથી જ લેવી પડે કે કોઈપણ બેંક ચાલે? SBI ની બેંક ગેરંટી ચાલશે?

ભારતની કોઈપણ બેંક ચાલશે: રાષ્ટ્રીયકૃત, ખાનગી કે શેડ્યુલ્ડ બેંક. તેથી SBI ની બેંક ગેરંટી પણ માન્ય છે.

પ્ર.11 બેંક એડિટ કરી શકાય તેવો (Word) નમૂનો માંગે છે. Word ફાઇલ મોકલી શકશો?

નમૂનો PDF માં આપેલ છે. કોઈપણ ફ્રી ઓનલાઇન PDF-to-Word કન્વર્ટરથી તેને Word માં ફેરવો, પછી વર્ષ બદલો અને તમારી વિગતો નમૂના મુજબ ભરો.

પ્ર.12 જૂનો (2023-24) નમૂનો વાપરી શકાય કે નવા નમૂનાની રાહ જોવી?

રાહ જોવાની જરૂર નથી. આપેલ નમૂનો વાપરો, વર્ષ બદલીને ચાલુ વર્ષ કરો અને તમારી વિગતો ભરો.

પ્ર.13 મારું ખાતું એ જ બેંકમાં છે પણ બીજી શાખામાં છે. શું BJMC નજીકની શાખામાંથી બેંક ગેરંટી મળી શકે?

કૃપા કરીને બેંકના અધિકારીઓને પૂછો; દરેક બેંકના નિયમો અલગ હોઈ શકે. એક્સિસ બેંક, અસારવા શાખા માટે શ્રી શિવાંગ ધુલિયા: +91 99250 57448 નો સંપર્ક કરી શકો.

પ્ર.14 માતા-પિતા બંને સરકારી નોકરીમાં છે. શું તેના બદલે ફોર્મ 16 કે પગાર પ્રમાણપત્ર ચાલશે?

ના. ₹5 લાખના ભાગ માટે ફક્ત બેંક ગેરંટી અથવા સોલ્વન્સી સર્ટિફિકેટ જ માન્ય છે (જુઓ પ્ર.4 અને પ્ર.5).

4. વિકલ્પ 2: સોલ્વન્સી (મિલકત)**પ્ર.15 સોલ્વન્સી એટલે શું, અને સોલ્વન્સી સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું?**

સોલ્વન્સી એટલે FD કરાવવાને બદલે બોન્ડની સિક્યોરિટી તરીકે મિલકત ગીરો (મોર્ગેજ) મૂકવી.

- મામલતદાર / તહસીલદાર કચેરીની મુલાકાત લો (મિલકતના રેકર્ડમાં નોંધ કરવા માટે જે કચેરી અધિકૃત હોય તે). તેઓ પ્રક્રિયામાં માર્ગદર્શન આપશે.
- મિલકતની કિંમત ₹5 લાખથી ઓછી ન હોવી જોઈએ.
- સોલ્વન્સી સર્ટિફિકેટ સાથે મિલકતના મૂલ્યાંકન (વેલ્યુએશન)નો દસ્તાવેજ જોડો.

પ્ર.16 કોની મિલકત વાપરી શકાય? ભાઈને વાલી તરીકે રાખીને સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવી શકાય?

કોઈપણ વ્યક્તિની મિલકત વાપરી શકાય. તે તમારી, તમારા પરિવારની, સગાંની કે મિત્રની હોઈ શકે, પરંતુ તેની કિંમત ₹5 લાખથી ઓછી ન હોવી જોઈએ.

પ્ર.17 મેં સાંભળ્યું છે કે મિલકતનું મૂલ્યાંકન સોલ્વન્સીની રકમ કરતાં ત્રણ ગણું (₹15 લાખથી વધુ) હોવું જોઈએ. શું આ સાચું છે?

કોલેજના જણાવ્યા મુજબ મિલકતની કિંમત ₹5 લાખથી ઓછી ન હોવી જોઈએ. સોલ્વન્સી સર્ટિફિકેટ સાથે મિલકતના મૂલ્યાંકનનો દસ્તાવેજ જોડો. જો મામલતદાર/તહસીલદાર કચેરી વધુ મૂલ્યાંકન માંગે, તો તેમની સૂચના મુજબ કરો.

પ્ર.18 શું ₹5 લાખની સોલ્વન્સી અમારા પોતાના ઘર પર કરાવી શકાય?

હા.

પ્ર.19 જે મિલકત પર લોન લીધેલ હોય તે સોલ્વન્સી માટે ચાલે?

હા, જો મિલકતની કિંમત લોનની રકમ કરતાં વધુ હોય તો. આ માટે મામલતદાર કચેરીમાં તપાસ કરો.

પ્ર.20 શું તહસીલદારનું સોલ્વન્સી (હેસિયત પ્રમાણપત્ર) બેંક ગેરંટીના બદલે ચાલશે?

હા. સોલ્વન્સી સર્ટિફિકેટ એ બેંક ગેરંટીનો માન્ય વિકલ્પ છે. બે માંથી કોઈ એક જ જોઈએ.

પ્ર.21 મિલકતની સોલ્વન્સી કેટલા વર્ષ માટે કરાવવાની?

સોલ્વન્સીની કોઈ નિશ્ચિત મુદત નથી. વિદ્યાર્થી બોન્ડની શરતો પૂર્ણ કરે ત્યાં સુધી મિલકત ગીરો રહે છે.

5. ₹15 લાખનું એફિડેવિટ

પ્ર.22 ₹15 લાખનો ભાગ શું છે? તે બોન્ડ છે કે એગ્રીમેન્ટ?

₹15 લાખનો ભાગ એ આપેલ નમૂના મુજબ ₹300 ના સ્ટેમ્પ પેપર પર સાદું એફિડેવિટ (બાંહેધરી પત્ર) છે. આ ભાગ માટે FD, બેંક ગેરંટી કે મિલકતની જરૂર નથી. તેના પર પણ ₹5 લાખના બોન્ડની જેમ જ વ્યક્તિઓની સહી જરૂરી છે (જુઓ વિભાગ 6).

6. સહી: વિદ્યાર્થી, વાલી, સ્યોરિટી (જામીન) અને સાક્ષી

પ્ર.23 બોન્ડના દસ્તાવેજો પર કોણ સહી કરે: વિદ્યાર્થી કે વાલી?

- વિદ્યાર્થી 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો હોય: વિદ્યાર્થી પોતે સહી કરે.
- વિદ્યાર્થી 18 વર્ષથી ઓછી ઉંમરનો હોય: માતા કે પિતામાંથી કોઈ એક વિદ્યાર્થી વતી સહી કરે.
- જે વાલી વિદ્યાર્થી વતી સહી કરે, તે સાક્ષી તરીકે સહી કરી શકે નહીં.

પ્ર.24 2 સ્યોરિટી અને 2 સાક્ષી જરૂરી છે. શું સ્યોરિટી અને સાક્ષી એક જ વ્યક્તિ હોઈ શકે?

ના. બંનેની ભૂમિકા અને નિયમો અલગ છે:

- સાક્ષી ફક્ત સહીની ખાતરી આપે છે. સાક્ષી તમારા ઘરનો સભ્ય હોઈ શકે છે.
- સ્યોરિટી (બાંહેધરી આપનાર / જામીન) એ જવાબદારી લે છે કે જો વિદ્યાર્થી બોન્ડની શરતો પૂર્ણ ન કરે તો બોન્ડની રકમ તે ચૂકવશે. સ્યોરિટી તમારા ઘરનો સભ્ય ન હોવો જોઈએ.

પ્ર.25 સાક્ષી કોણ બની શકે?

- તમારા ઘરનો કોઈપણ સભ્ય, જેમ કે માતા, પિતા, ભાઈ, ભાભી, દાદા કે દાદી.
- એ જ સાક્ષીઓ બંને ફોર્મ (₹5 લાખ અને ₹15 લાખ) પર સહી કરી શકે છે.
- સાક્ષીઓ વિદ્યાર્થીના જ સરનામે રહેતા હોય તો પણ ચાલશે.
- દરેક સાક્ષીનું આધાર કાર્ડ અને સરનામાનો પુરાવો (ટેક્સ બિલ કે લાઇટ બિલ) જોડો.

પ્ર.26 સ્યોરિટી કોણ બની શકે? સગાં ચાલે? માતા-પિતા સ્યોરિટી બની શકે?

- માતા-પિતા કે ઘરના અન્ય સભ્યો સ્યોરિટી બની શકે નહીં, કારણ કે તેઓ વિદ્યાર્થીના જ સરનામે રહે છે.
- સ્યોરિટી એવી વ્યક્તિ હોવી જોઈએ જે વિદ્યાર્થીથી અલગ સરનામે રહેતી હોય, જેમ કે સગાં (કાકા-કાકી, મામા-મામી, ફોઈ-ફુઆ) કે મિત્રો.
- એક ફોર્મ પરના બે સ્યોરિટી એકબીજા સાથે એક જ સરનામે રહેતા હોય (જેમ કે કાકા અને કાકી) તો ચાલશે, પરંતુ વિદ્યાર્થીના સરનામે નહીં.
- દરેક સ્યોરિટીનું આધાર કાર્ડ અને સરનામાનો પુરાવો (ટેક્સ બિલ કે લાઇટ બિલ) જોડો.

પ્ર.27 શું બંને ફોર્મ પર એ જ સ્યોરિટી સહી કરી શકે?

₹5 લાખ અને ₹15 લાખના ફોર્મ પર અલગ અલગ સ્યોરિટી રાખવા હિતાવહ છે, એટલે કે કુલ 4 સ્યોરિટી.

- જો એ જ વ્યક્તિઓ બંને ફોર્મ પર સહી કરે, તો તેઓ દરેક પૂરા ₹20 લાખની બાંહેધરી આપે છે.
- જો અલગ વ્યક્તિઓ સહી કરે, તો ₹5 લાખના ફોર્મ પર સહી કરનારની જવાબદારી ₹5 લાખની અને ₹15 લાખના એફિડેવિટ પર સહી કરનારની જવાબદારી ₹15 લાખની રહે છે.

પ્ર.28 શું સ્યોરિટી અને સાક્ષીના નામે લાઇટ બિલ જરૂરી છે? એટલે કે પસંદ કરેલ વ્યક્તિનું નામ લાઇટ બિલ પર હોવું જોઈએ?

દરેક સ્યોરિટી અને સાક્ષીએ આધાર કાર્ડ અને સરનામાનો પુરાવો, જેમ કે ટેક્સ બિલ કે લાઇટ બિલ, જોડવાનો રહેશે. આવો પુરાવો આપી શકે તેવી વ્યક્તિઓ પસંદ કરો.

7. જો FD કે મિલકત ન હોય તો

પ્ર.29 FD માટે પૈસા કે સોલ્વન્સી માટે મિલકત ન હોય તો શું કરવું?

- મિલકત તમારી પોતાની હોવી જરૂરી નથી. સોલ્વન્સી માટે સગાં કે મિત્રની મિલકત પણ વાપરી શકાય (જુઓ પ્ર.16).
- તમે સગાંની મદદ લઈ શકો, અથવા FD માટે એજ્યુકેશન લોન લઈ શકો.

8. ફોર્મ અને દસ્તાવેજો જમા કરાવવા

પ્ર.30 બોન્ડના ફોર્મ ક્યાંથી મળશે?

તમામ નમૂના (બેંક ગેરંટીના નમૂના, ₹5 લાખનો બોન્ડ અને ₹15 લાખનું એફિડેવિટ) વિદ્યાર્થીઓના ગ્રુપમાં મૂકવામાં આવ્યા છે.

પ્ર.31 બોન્ડના દસ્તાવેજો જમા કરાવવાની છેલ્લી તારીખ કઈ છે? ક્યાં જમા કરાવવા?

બોન્ડના પૂર્ણ દસ્તાવેજો 15 ઓક્ટોબર 2026 પહેલાં કોલેજમાં જમા કરાવો.

પ્ર.32 કોલેજ બદલવાનો વિચાર નથી અને બોન્ડ તથા સોલ્વન્સીના કાગળો તૈયાર છે, તો શું અત્યારે જમા કરાવી શકાય?

હા. દસ્તાવેજો પૂર્ણ થાય એટલે કોલેજમાં જમા કરાવી શકો. છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2026 છે.